



Hindustan Oil Exploration Company Limited

'Lakshmi Chambers', 192, St. Mary's Road, Alwarpet, Chennai - 600 018. INDIA.

☎: 91 (044) 66229000 • Fax: 91 (044) 66229011 / 66229012

E-mail: contact@hoec.com • Website: www.hoec.com CIN: L11100GJ1996PLC029880

November 11, 2023

By Online

The Listing Department National Stock Exchange of India Ltd., "Exchange Plaza", Bandra Kurla Complex, Bandra (East), MUMBAI – 400 051 Stock Code: HINDOILEXP	The Corporate Relationship Department BSE Limited, 1 st Floor, P. Jeejeebhoy Towers, Dalal Street, MUMBAI – 400 001 Stock Code: 500186
--	---

Dear Sir/Madam,

Sub: Submission of the copy of Newspaper Advertisement towards publication of Financial Results for the quarter ended September 30, 2023

Pursuant to Regulation 47(3) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed the copy of Newspaper Advertisements published in Business Line (All editions), Business Standard (Ahmedabad Edition) and Loksatta (Baroda Edition) pertaining to the Financial Results for the quarter ended September 30, 2023.

The above information is also available on the website of the Company – www.hoec.com

We request you to take the submission on record.

Thanking You,
Yours Sincerely,
For Hindustan Oil Exploration Company Limited

R.Jeevanandam
Managing Director
(Din 07046442)

Encl: a/a

Bank of Baroda
Bank of Baroda
Bank of Baroda

Bank of Baroda Surat District Region, 6th Floor, Baroda Sun Complex, Ghod Dod Road, Surat - 395007

Notice Inviting Tender
 The Bank of Baroda invites offers from the owners/Power of attorney holders of premises on ground floor for shifting following branches with all facilities including adequate power:

Sr. No.	Name Of Branch	Preferably Location	Area required in sq.ft.
1.	Bardoli Main Branch - Surat	In and around the Prominent Place/ Main road of our branch.	2100 - 2300 Sq.ft
2.	Kanza, Tapi		1220-1532 Sq.ft
3.	Kadod - Surat		1330 - 1672 Sq.ft

The premises shall be ready for occupation. The intending offerers shall submit their offers in two separate sealed cover super scribed Technical bid and Price bid to The Regional Manager, Bank of Baroda Surat District Region, 6th Floor, Ghod Dod Road, Surat - 395007 on or before **4.00 PM of 01-12-2023**. Priority would be given to the premises belonging to Public Sector Units / Govt. Departments. (For details please log in on tender section of our web site www.bankofbaroda.com.) The bank reserves its right to accept or reject any offer without assigning reasons therefor.

Place : Surat | Date : 10-11-2023 The Regional Manager, Surat District Region, Surat

PUBLIC NOTICE FOR TITLE CLEAR
 This is hereby informed to General Public That, I have offered title clearance report for the properties mentioned below.

That, The owner of land bearing Block/Survey No. 439 Paiki 1 total admeasuring 15030 sq.mtrs., T.P. Scheme No. 3 (Katargam) Final Plot No. 171/A and 171/B Paiki land bearing Final Plot No. 171/B admeasuring 1970 sq. mtrs. of Village: Katargam, Sub District : Surat City(Katargam), District: Surat declared that the original documents paiki below mentioned document is lost by owner and declaring the same they have offered said property to my client Bank as security. Therefore, if any person, Bank, or Financial institute has any interest in the said property, contact at below address mentioned herein below within 7 days of publication of this notice with all relevant documents. Upon expiration of the notice period Bank will proceed further and afterwards there will be first charge of my client over the said properties and afterwards No rights/claim/Objection will be entertained.

Details of the lost documents
 Original power of attorney executed by Manilal Alias Manibhai Gandabhai Patel in favour of Karshanbhai Gandabhai Patel. Date: 11/11/2023

Neha H. Koradia Advocate and Notary
 Office No. 8,9,10, Haridarshan Complex, Katargam Darwaja, Surat. Mo. No. 99090 90222

Suman O. Rajput Advocate
 403, Shubham, Por Mahollo, Nanpura, Surat Mo. No. 98798 16360

IDFC FIRST Bank Limited
 (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)
 CIN : L65110TN2014PLC097792
 Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

**APPENDIX IV [Rule 8(1)]
 POSSESSION NOTICE (For immovable property)**

Whereas the undersigned being the Authorised Officer of the IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 14.06.2023 calling upon the borrower, co-borrowers and guarantors 1. Vijaybhai Dineshbhai Patel, 2. Minaben Vijaybhai Patel to repay the amount mentioned in the notice being Rs. 8,25,165.81/- (Rupees Eight Lac Twenty Five Thousand One Hundred Sixty Five and Eighty One Paise Only) as on 13-06-2023 within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 7th day of November 2023.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 8,25,165.81/- (Rupees Eight Lac Twenty Five Thousand One Hundred Sixty Five and Eighty One Paise Only) and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Properties
 All That Piece And Parcel Of Property No. 199, Admeasuring 15 X 55 = 825 Sq. Ft. Situated At Moje Village: Bartad, Taluka: Mahuva, District: Surat, Gujarat- 394240, And Bounded As: East : Seenaben House, West : Dipakbhai House, North : Ishwarbhai House South : Kasiben House

Sd/-
 Authorised Officer
 IDFC First Bank Limited
 (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)

Date : 7th November 2023
 Place : Surat
 Loan Account No : 45644190

ONE POINT ONE SOLUTIONS LIMITED
 (CIN: L74900MH2008PLC182869)
 Registered Office: International Infotech Park, T-762, Tower-7, 6th Floor, Vashi, Navi Mumbai -400703.
 Tel No.: + 91 (22) 6687 3800, Fax No.: + 91 (22) 6687 3889, Website: www.1point1.com Email: investors@1point1.in

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER 2023
 (Rs. in Lakhs except per share data)

Particulars	Quarter Ended			Half year ended		
	30/09/2023 (Unaudited)	30/06/2023 (Unaudited)	30/09/2022 (Unaudited)	30/09/2023 (Unaudited)	30/09/2022 (Unaudited)	31/03/2023 (Audited)
Total Income from Operations	4,101.32	3,873.59	3,491.99	7,974.91	6,997.40	14,423.98
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	832.98	459.09	268.15	1,292.07	510.42	1,282.16
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	832.98	459.09	268.15	1,292.07	510.42	1,282.16
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	592.76	282.62	191.26	875.39	370.10	878.96
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	585.74	278.48	176.79	864.23	356.11	856.12
Equity Share Capital	3,908.77	3,908.77	3,761.19	3,908.77	3,761.19	3,761.19
Reserves (excluding Revaluation Reserve)						1,758.72
Earnings Per Share (of Rs. 10/- each)						
Basic:	0.30	0.15	0.10	0.45	0.20	0.47
Diluted:	0.30	0.15	0.10	0.45	0.20	0.47

Extract of unaudited standalone financial results for the quarter and half year ended 30th September 2023:

Particulars	Quarter Ended			Half year ended		
	30/09/2023 (Unaudited)	30/06/2023 (Unaudited)	30/09/2022 (Unaudited)	30/09/2023 (Unaudited)	30/09/2022 (Unaudited)	31/03/2023 (Audited)
Total Income from Operations	4,101.32	4,023.14	3,491.00	8,124.46	6,995.24	14,419.86
Profit before tax	833.75	609.42	268.59	1,443.16	511.35	1,286.14
Profit after tax	595.15	430.31	191.60	1,025.46	366.18	876.31

Note
 - The above results were reviewed by Audit Committee & approved by Board of Directors in its meeting dated 9th November 2023.
 - The above is an extract of detailed format of financial results filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirement) Regulations, 2015. The full format of financial results is available on the website of National Stock Exchange of India Limited and the Company.

Place: Navi Mumbai
 Date: 9th November 2023

Sd/-
 Akshay Chhabra
 Chairman and Managing Director

RELIANCE MEDIAWORKS FINANCIAL SERVICES PRIVATE LIMITED
 (CIN : U74999MH2017PTC292285)
 Registered Office: Floor-6, Plot-90, 8, Manek Mahal, Veer Nariman Road, Churchgate, Mumbai-400020
 Email: rmwfinvestor@gmail.com Website: www.reliancemediaworks.com

Extract of Unaudited Financial Results for the Quarter and Half Year Ended September 30, 2023
 [Regulation 52(8), read with regulation 52(4)] (Rs. in Hundred)

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended
		30.09.2023 Unaudited	30.09.2022 Unaudited	31.03.2023 Audited
1	Total income from Operations	-	-	15.41
2	Net Profit / (Loss) for the period before Tax (before Exceptional and/or Extraordinary items)	(9,32,104.15)	(9,37,511.88)	(37,20,164.40)
3	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(9,32,104.15)	(9,37,511.88)	(37,20,164.40)
4	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(9,32,104.15)	(9,37,511.88)	(37,20,164.40)
5	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10/- Each)	1,05,01,000.00	1,05,01,000.00	1,05,01,000.00
6	Reserves (excluding Revaluation Reserve)	(8,49,89,280.34)	(8,13,02,029.61)	(8,31,32,589.50)
7	Security Premium	-	-	-
8	Net worth	(7,44,88,280.34)	(7,08,01,029.61)	(7,26,31,589.50)
9	Outstanding Debt	6,06,31,562.86	6,06,31,562.84	6,06,31,562.86
10	Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil
11	Debt Equity Ratio	(0.81)	(0.86)	(0.83)
12	Earning Per Share (of Rs. 10/- each Fully paid-up) Basic & Diluted	(0.88)	(0.09)	(3.54)
13	Capital Redemption Reserve	-	-	-
14	Debenture Redemption Reserve (DRR)	-	-	-
15	Debt Service Coverage Ratio	-	-	-
16	Interest Service Coverage Ratio	-	-	-

Notes:
 1. The above unaudited statement of Financial results for the Quarter and Half Year ended 30th September, 2023 have been reviewed and approved by the Board of Directors in the meeting held on 10th November, 2023. The Statutory Auditors of the Company have carried out the above Financial Results and have issued Limited Review Report.
 2. These results have been prepared in accordance with the provisions of Section 133 of the Companies Act, 2013 read with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) as amended from time to time.
 3. The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchange under regulation 52 of the Listing Regulations. The full format of the quarterly financial results is available on the websites of the Stock Exchange and the listed entity at <http://www.reliancemediaworks.com/investor-desk>.
 4. For the other line items referred in regulation 52(4) of the Listing Regulations, pertinent disclosures have been made to the Stock Exchange Bombay Stock Exchange (BSE) and can be accessed on the <http://www.reliancemediaworks.com/investor-desk>.

Place : Mumbai
 Date : November 10, 2023

For Reliance MediaWorks Financial Services Private Limited
 Monika Sharma
 Whole Time Director (DIN: 08670391)

HOEC HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED
 Registered Office: 'HOEC House', Tandalja Road, Off Old Padra Road, Vadodara-390 020.
 Website: www.hoec.com Email: hoecshare@hoec.com CIN: L11100GJ1996PLC029880

Extract of statement of standalone and consolidated unaudited financial results for the quarter and half year ended September 30, 2023
 (₹ in lacs except per share data)

S. No.	Particulars	Standalone						Consolidated					
		Quarter ended			Half year ended			Quarter ended			Half year ended		
		Sep 30, 2023 Unaudited	Jun 30, 2023 Unaudited	Sep 30, 2022 Unaudited	Sep 30, 2023 Unaudited	Sep 30, 2022 Unaudited	March 31, 2023 Audited	Sep 30, 2023 Unaudited	Jun 30, 2023 Unaudited	Sep 30, 2022 Unaudited	Sep 30, 2022 Unaudited	Sep 30, 2022 Unaudited	March 31, 2023 Audited
1	Total Income from Operations	7,083.76	10,046.36	8,169.16	16,950.96	15,188.62	40,895.67	11,549.07	17,385.26	12,578.60	28,660.78	21,682.80	56,771.08
2	Net Profit for the period (before tax and exceptional items)	3,874.92	2,134.11	656.42	6,009.03	4,077.61	16,366.73	4,409.32	6,760.58	1,853.80	11,169.90	5,124.30	20,951.17
3	Net Profit for the period before tax (after exceptional items)	3,874.92	2,134.11	656.42	6,009.03	4,077.61	16,366.73	4,409.32	6,760.58	1,853.80	11,169.90	5,124.30	19,729.18
4	Net Profit for the period after tax (after Exceptional items)	3,874.92	2,134.11	656.42	6,009.03	4,077.61	16,366.73	4,317.79	6,607.17	1,770.78	10,924.96	5,005.85	19,404.82
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	3,872.55	2,134.90	655.40	6,007.45	4,075.58	16,369.90	4,315.42	6,607.96	1,769.76	10,923.38	5,003.82	19,407.99
6	Equity Share Capital	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93
7	Reserves						79,740.47						81,494.32
8	Earnings Per Share (Face value of ₹ 10/-each)(not annualized)												
	Basic EPS ₹	₹ 2.93	₹ 1.61	₹ 0.50	₹ 4.54	₹ 3.08	₹ 12.37	₹ 3.26	₹ 5.00	₹ 1.34	₹ 8.26	₹ 3.78	₹ 14.67
	Diluted EPS ₹	₹ 2.93	₹ 1.61	₹ 0.50	₹ 4.54	₹ 3.08	₹ 12.37	₹ 3.26	₹ 5.00	₹ 1.34	₹ 8.26	₹ 3.78	₹ 14.67

The above is an extract of detailed format of quarterly financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015. The full format of the quarterly financial results is available on the Stock Exchange websites www.bseindia.com, www.nseindia.com and Company's website www.hoec.com.

Place : Chennai
 Date : November 10, 2023

BY ORDER OF THE BOARD
 For Hindustan Oil Exploration Company Limited

R. Jeevanandam
 Managing Director
 DIN: 0704642

Opinion, Insight Out

Opinion, Monday to Saturday

To book your copy, sms reachbs to 57575 or email order@bsmail.in

Business Standard Insight Out

bsindia business.standard

business-standard.com

India breezes ahead with Taiwan labour supply pact

TAPPING TALENT. Taiwan may hire 1 lakh Indians

Bloomberg

India is forging closer economic ties with Taiwan with a plan to send lakhs of Indian workers to the island as early as next month, according to senior officials, potentially angering neighbour China.

Taiwan could hire as many as one lakh Indians to work at factories, farms and hospitals, the officials said.

AGEING SOCIETY

The two sides are expected to sign an employment mobility agreement by as early as December, the people said. Taiwan's ageing society means it needs more workers, while in India, the economy isn't growing fast enough to create enough jobs for the millions of young people who enter the labour market every year. Taiwan is projected to become a "super aged" society by 2025 with elderly people forecast to make up for more than a fifth of the population.

However, the employment deal is likely to ramp up geopolitical tensions



AGREEMENT SOON. The two sides are expected to sign an employment mobility pact by as early as December. REUTERS

with China, which opposes any official exchange with Taiwan.

A pact with Taiwan doesn't suggest India is discarding the "One China Policy"—a position that recognises the island as being a part of China. However, New Delhi hasn't reiterated that position in public documents and has instead fostered an active unofficial relationship with Taiwan. The India-Taiwan jobs pact is now in the final stages of negotiation, Arindam Bagchi, a spokesperson for India's Ministry of External Affairs, told reporters on Thursday.

PAY PARITY

A mechanism to certify the health of Indian workers

willing to move to Taiwan is still being worked out, people familiar with the discussions said. In Taiwan, where the unemployment rate dropped to the lowest levels since 2000, the government needs workers to keep the \$790-billion economy going.

Taiwan is offering the Indian workers pay parity with locals and insurance policies to sweeten the deal, unlike other countries that New Delhi has struck agreements with, the people said. India, which overtook China to become the world's most populous country this year, the government is pushing employment pacts with developed countries facing ageing workforces.

Apple all set to challenge EU crackdown on Big Tech dominance

Bloomberg

Apple Inc is set to challenge the European Union's fresh crackdown on Big Tech's dominance in the first of what is expected to be several appeals against the Digital Markets Act.

The company will dispute the EU regulator's decision to put all of the App Store into the bloc's new digital antitrust list. It'll argue also its iMessage service shouldn't be subject to closer scrutiny from regulators, according to people familiar with the matter.

DRAFT FORM

Apple's appeal is still in draft form and could change before the November 16 deadline to file challenges at the EU's General Court, the people said who asked not to be identified because the matter is private. Apple and the European Commission didn't immediately respond



to requests for comment.

The move could set the stage for yet another legal stand-off between the world's biggest tech company and the EU. Apple is battling EU lawyers in a dispute over alleged unpaid taxes in Ireland. Apple also faces separate EU antitrust probes into its tap-and-pay technology and into its treatment of music streaming rivals such as Spotify Technology SA.

The bloc's new DMA rules impose a rigid regime on the largest digital firms and boost the EU commission's existing powers as the re-


gion's antitrust enforcer. It will be illegal for certain platforms to favour their own services over those of rivals. They'll be barred from combining personal data across their different services, prohibited from using data they collect from third-party merchants to compete against them, and will have to allow users to download apps from rival platforms.

Even with an appeal pending, Apple will still be required to comply with the rules when they take effect on March 6. Apple said in a filing this month that it expects to make changes to the App Store as a result of the bloc's new rules.

Alphabet Inc's Google Search, Apple's Safari, Amazon.com Inc's marketplace, Bytedance Ltd's TikTok and Meta Platforms Inc.'s Facebook are among a list of 22 Big Tech services that come under the scope of the EU's Digital Markets Act.

Tata Chemicals Q2 net profit dips 28% to ₹495 cr

Press Trust of India
New Delhi



Tata Chemicals Ltd on Friday reported a 28 per cent decline in consolidated net profit at ₹495 crore for the second quarter of this fiscal year.

Its net profit stood at ₹685 crore in the year-ago period.

Income from operations fell to ₹3,998 crore in the July-September period, as compared to ₹4,239 crore in the corresponding quarter of last year (Q2FY23).

"PAT (profit after tax) on a consolidated basis, stood at ₹495 crore, for the quarter, as compared to ₹685 crore in Q2FY23. PAT includes an exceptional item of ₹102 crore," Tata Chemicals said in a regulatory filing.

As on September 30, 2023, the consolidated Gross Debt dropped to ₹6,048 crore, as compared to ₹6,296 crore as on March 31, 2023.

"The demand environment for soda ash in domestic markets in India and the US was stable. In other markets, softness was observed especially in container glass and flat glass sectors, leading to pricing pressure," R Mukundan, Managing Director and CEO, Tata Chemicals Ltd, said.

The company's market share in key markets have remained relatively stable by staying close to customers, he added.

"Our endeavour is to continue to maintain our market share through customer engagement and have steady contribution margins with focus on costs and higher value-added products. Our focus will also be to conserve cash and continue to deleverage."

"Looking beyond short-term, we expect the medium-term demand-supply situation to remain balanced driven by the sustainability trends especially for applications like solar glass and lithium," Mukundan said.

A part of the USD 150 billion Tata Group, Tata Chemicals Limited, is a leading supplier of choice to glass, detergent, industrial and chemical sectors.

The company has a strong position in the crop protection business through its subsidiary company, Rallis India Ltd.



HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED

Registered Office: 'HOEC House', Tandalja Road, Off Old Padra Road, Vadodara-390 020.
Website: www.hoec.com Email: hoecshare@hoec.com CIN: L11100GJ1996PLC029880

Extract of statement of standalone and consolidated unaudited financial results for the quarter and half year ended September 30, 2023

S. No.	Particulars	Standalone						Consolidated					
		Quarter ended			Half year ended			Quarter ended			Half year ended		
		Sep 30, 2023	Jun 30, 2023	Sep 30, 2022	Sep 30, 2023	Sep 30, 2022	March 31, 2023	Sep 30, 2023	Jun 30, 2023	Sep 30, 2022	Sep 30, 2023	Sep 30, 2022	March 31, 2023
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	7,083.76	10,046.36	8,169.16	16,950.96	15,188.62	40,895.67	11,549.07	17,385.26	12,578.60	28,660.78	21,682.80	56,771.08
2	Net Profit for the period (before tax and exceptional items)	3,874.92	2,134.11	656.42	6,009.03	4,077.61	16,366.73	4,409.32	6,760.58	1,853.80	11,169.90	5,124.30	20,951.17
3	Net Profit for the period before tax (after exceptional items)	3,874.92	2,134.11	656.42	6,009.03	4,077.61	16,366.73	4,409.32	6,760.58	1,853.80	11,169.90	5,124.30	19,729.18
4	Net Profit for the period after tax (after Exceptional items)	3,874.92	2,134.11	656.42	6,009.03	4,077.61	16,366.73	4,317.79	6,607.17	1,770.78	10,924.96	5,005.85	19,404.82
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	3,872.55	2,134.90	655.40	6,007.45	4,075.58	16,369.90	4,315.42	6,607.96	1,769.76	10,923.38	5,003.82	19,407.99
6	Equity Share Capital	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93
7	Reserves						79,740.47						81,494.32
8	Earnings Per Share (Face value of ₹ 10/-each)(not annualized)												
	Basic EPS ₹	₹ 2.93	₹ 1.61	₹ 0.50	₹ 4.54	₹ 3.08	₹ 12.37	₹ 3.26	₹ 5.00	₹ 1.34	₹ 8.26	₹ 3.78	₹ 14.67
	Diluted EPS ₹	₹ 2.93	₹ 1.61	₹ 0.50	₹ 4.54	₹ 3.08	₹ 12.37	₹ 3.26	₹ 5.00	₹ 1.34	₹ 8.26	₹ 3.78	₹ 14.67

The above is an extract of detailed format of quarterly financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015. The full format of the quarterly financial results is available on the Stock Exchange websites www.bseindia.com, www.nseindia.com and Company's website www.hoec.com.

BY ORDER OF THE BOARD
For Hindustan Oil Exploration Company Limited

Place : Chennai
Date : November 10, 2023

R. Jeevanandam
Managing Director
DIN: 07046442



CIN No: L15331KL1963PLC002028

Registered Office: Post Box No. 20, Solvent Road, Irinjalakuda, Kerala - 680 121
Ph: 0480 2825476 E-mail: ksekerala@gmail.com Web: www.kselimited.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2023

Particulars	Rs. in lakhs					
	Quarter ended			Half year ended		Year ended
	30.09.2023 Unaudited	30.06.2023 Unaudited	30.09.2022 Unaudited	30.09.2023 Unaudited	30.09.2022 Unaudited	31.03.2023 Audited
Total Income from Operations	43748.07	42568.14	39518.38	86316.21	80589.81	161540.18
Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extra-ordinary Items)	(170.03)	(157.88)	574.41	(327.91)	267.07	(417.10)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extra-ordinary Items)	(170.03)	(157.88)	574.41	(327.91)	267.07	(298.63)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extra ordinary items)	(141.56)	(105.32)	425.29	(246.88)	194.80	(238.14)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(157.71)	(225.69)	370.85	(383.40)	157.92	(232.84)
Paid up Equity Share Capital	320.00	320.00	320.00	320.00	320.00	320.00
Other Equity						21085.16
Earnings Per Equity Share of Rs.10 each (for continuing and discontinued operations) (not annualised)						
Basic (Rs.)	(4.42)	(3.29)	13.29	(7.71)	6.09	(7.44)
Diluted (Rs.)	(4.42)	(3.29)	13.29	(7.71)	6.09	(7.44)

Note: The above is an extract of the detailed format of the Financial Results for the Quarter ended 30th September, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the Quarter and Half year ended 30th September, 2023 are available on the Stock Exchange website at www.bseindia.com and on the Company's website at www.kselimited.com

For KSE Limited

Sd/-
M.P. JACKSON
(DIN 01889504)
Managing Director

Irinjalakuda
10th November, 2023

3M INDIA LIMITED

CIN:L31300KA1987PLC013543, Regd Office: 48-51, Electronics City, Hosur Road, Bengaluru - 560100, Website: www.3m.com/in

Extract of the Standalone and Consolidated Financial Results for the quarter and half year ended 30 September 2023

Particulars	(Rs. in Lakhs, except per share data, unless otherwise stated)							
	Standalone				Consolidated			
	3 months ended 30 Sep. 2023 (Unaudited)	6 months ended 30 Sep. 2023 (Unaudited)	3 months ended 30 Sep. 2022 (Unaudited)	12 months ended 31 March 2023 (Audited)	3 months ended 30 Sep. 2023 (Unaudited)	6 months ended 30 Sep. 2023 (Unaudited)	3 months ended 30 Sep. 2022 (Unaudited)	12 months ended 31 March 2023 (Audited)
Total income from operations (including other income)	99,015.11	1,97,880.46	95,899.63	3,79,766.33	1,05,695.59	2,12,074.39	1,01,145.37	4,02,746.36
Net Profit for the period (before tax, Exceptional and / or Extraordinary items)	17,949.86	33,604.02	13,402.35	56,079.61	19,591.33	36,917.45	14,268.48	60,743.81
Net Profit for the period before tax (after Exceptional and / or Extraordinary items)	17,949.86	33,604.02	13,402.35	56,079.61	19,591.33	36,917.45	14,268.48	60,743.81
Net Profit for the period after tax	13,379.65	25,046.59	9,986.00	41,614.39	14,611.49	27,532.67	10,623.37	45,101.92
Total comprehensive income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	13,390.76	25,068.81	10,013.47	41,658.80	14,621.73	27,553.15	10,655.19	45,142.87
Equity share capital	1,126.51	1,126.51	1,126.51	1,126.51	1,126.51	1,126.51	1,126.51	1,126.51
Reserves (excluding revaluation reserves as per Ind AS)				1,93,657.31				1,66,620.54
Earnings per share (in Rs.) (of Rs. 10/- each)								
a) Basic (in Rs.)	118.77	222.34	88.65	369.41	129.71	244.41	94.30	400.37
b) Diluted (in Rs.)	118.77	222.34	88.65	369.41	129.71	244.41	94.30	400.37

Notes:

- The above unaudited standalone and consolidated financial results of 3M India Limited and its subsidiary, 3M Electro & Communication India Private Limited (hereafter refer to as the 'Group') have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on 10 November 2023.
- The above is an extract of the detailed format for the unaudited financial results for the quarter and half year ended 30 September 2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format for the unaudited financial results for the quarter and half year ended 30 September 2023 are available on the BSE Limited website (www.bseindia.com), the National Stock Exchange India Limited website (www.nseindia.com) and on the Company's website (https://www.3mindia.in/3M/en_IN/company-in/about-3m/financial-facts-local/).
- The financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as notified by the Ministry of Corporate Affairs pursuant to Section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standard) Rules 2015, as amended and in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Place: Bengaluru
Date: 10 November 2023

By Order of the Board
For 3M India Limited

Ramesh Ramadurai
Managing Director

